

WEL/SEC/2024

June 10, 2024

To,

|  |   |
|--|---|
| <b>BSE Limited</b><br>1st Floor, Rotunda Bldg,<br>Dalal Street, Fort,<br>Mumbai - 400 001.<br>Scrip Code: 532553 | <b>National Stock Exchange of India Limited</b><br>Exchange Plaza, C-1, Block-G,<br>Bandra Kurla Complex, Bandra (East),<br>Mumbai - 400 051.<br>NSE Symbol: WELENT |
|--|---|

Dear Madam / Sir,

**Sub: Compliance under Regulation 47(1)(d) the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.**

Pursuant to Regulation 47(1)(d) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith Newspaper copies of Advertisement for Book Closure notice which was published on June 08, 2024 in Financial Express (English – All editions) and Kutch Mitra and Kutch Uday (Gujarati).

Kindly take note of the above.

Thanking you,

**For Welspun Enterprises Limited**

Nidhi Manas  
Tanna

Digitally signed by  
Nidhi Manas Tanna  
Date: 2024.06.10  
12:29:54 +05'30'

**Nidhi Tanna**  
**Company Secretary**  
**ACS – 30465**

**Welspun Enterprises Limited**

Welspun House, Kamala City, Senapati Bapat Marg, Lower Parel (W), Mumbai 400013, India

T: +91 22 6613 6000 / 2490 8000 | F: +91 22 2490 8020

E-mail: companysecretary\_wel@welspun.com | Website: www.welspunenterprises.com

Registered Address: Welspun City, Village Versamedi, Taluka Anjar, District Kutch, Gujarat 370110. India

T: +91 28 3666 2222 | F: +91 28 3627 9010

Corporate Identity Number: L45201GJ1994PLC023920

# Sebi proposes to open CDS market for MFs

AKSHATA GORDE  
Mumbai, June 7

**IN A BID TO** deepen the corporate bond market, the Securities and Exchange Board of India (Sebi) has proposed allowing all mutual funds (MFs) to buy and sell credit default swaps (CDS) in their schemes.

“The same shall serve as an additional investment product for mutual funds and also aid in increasing liquidity in the corporate bond market,” Sebi said in a consultation paper on Friday, inviting public comments by July 1.

Sebi’s proposal comes after the RBI issued revised CDS framework 2022, which sought to increase the base of protection sellers, including selling of protection by all major non-bank regulated entities, including mutual funds.

CDS is a credit derivative contract that allows an investor to swap or offset their credit risk with that of another investor, and is akin to insurance. To swap the risk of default, the lender buys a CDS from another investor who agrees to reimburse them if the borrower defaults.

The CDS market hasn’t



■ CDS is a credit derivative contract that allows an investor to swap or offset their credit risk with that of another investor

■ Sebi’s proposal comes after the RBI issued revised CDS framework 2022

really taken off in India because it is not useful in case of debt papers which is AAA-rated or backed by sovereign guarantee. At the same time, there isn’t much appetite for lower grade papers. In fact, the liquidity for the corporate bonds below AA-credit is extremely low. Debt fund managers taking risk on lower rated papers for higher returns have often found themselves in deep trouble at times due to their sheer inability to sell at the slightest whiff of trouble.

In fact, Sebi had allowed MFs to participate in the CDS market a decade back as protection for buyers – only for hedging their credit risk – the market did not take off.

Even the current proposals have caps for fund houses’ investment in CDS. Sebi has put a cap of 10% of the AUM of the scheme as these contracts are less liquid, and should be within the overall limit of derivatives assets as said in the scheme information document.

In addition, it has proposed that all schemes of a mutual fund be allowed to buy default swaps, which is currently limited to only fixed maturity plans of more than one year. But has maintained that mutual funds can buy these only for the purpose of hedging their credit risk on debt securities they hold in all schemes. Any naked exposure may not be allowed as it leads to speculative positions being held by MFs, Sebi said.

Further, a mutual fund can buy CDS only from programmes that are rated by credit rating agencies, and they can buy CDS for both investment grade and below-investment grade debt securities.

# Modi stakes claim to form ‘consensus’ govt

“In these 10 years, the global image of *Bharat* — it has come up as *Vishwabandhu* (a friend of the world) — has improved. These five years will be very useful for India globally. The world is going through many problems. We have been known as the fastest growing economy. The world is praising us. With a stable government and a familiar leadership, the world will look towards India all the more. We will move forward with resolve,” he said.

Following the visit of the NDA delegation, Rashtrapati Bhavan, in a communique, said: “The President, having satisfied himself on the basis of the various letters of support received, that the BJP-led NDA alliance, which is also the largest pre-election alliance, is in a position to command majority support of the newly constituted 18th Lok Sabha and to form a stable government, appointed Narendra Modi as the Prime Minister of India exercising powers vested in her under Article 75(1) of the Constitution of India.”

At the NDA meeting held in the historic Central Hall of the old Parliament building, Modi, who led a bitter election campaign against opponents, presented himself as a coalition leader, underlining the need to carry everyone along for a *Viksit Bharat*. He exuded confidence to lead the coalition, noting “NDA has completed around three decades, it is no ordinary thing... I can say that this is the most successful alliance.” As soon as he entered the Central Hall, Modi, whose party’s campaign slogan of 400-plus seats for the NDA was decry by the Opposition as an attempt to change the Constitution, bowed before a copy of the Constitution placed there and lifted it to his forehead reverentially.

Key allies TDP chief N Chandrababu Naidu and Bihar chief minister and JD(U) leader Nitish Kumar endorsed Modi’s leadership. “Today, India is having the right leader at the right

time, that is Narendra Modi. This is a very good opportunity for India. If you miss now, you will miss forever. That is why we are having a wonderful opportunity today,” said Naidu who called Modi a “great asset to the nation”.

Nitish Kumar said, “I am confident that whatever is left will now be completed. We will be with him at every step.” Shiv Sena (Shinde) leader and Maharashtra CM Eknath Shinde said the ties between BJP and his party are an ideological match.

Using a line from a popular advertisement, he said, “What I will say about the Shiv Sena is that the party and the BJP have a common ideology and the alliance, which was formed by Bal Thackeray, is a *Fevicol* bond and will not break (*Yeh Fevicol ka jod hai, tootega nahin*).”

The MPs unanimously endorsed a resolution moved by defence minister Rajnath Singh to elect Modi as the leader of BJP parliamentary party and the leader of Lok Sabha.

What everyone noticed was Modi’s constant mention of the NDA, not the BJP. “I keep NDA on one side and the aspirations and resolve of people of India, then I would say NDA: New India, Developed India, Aspirational India.”

According to Modi, the NDA is “not just the coming together of some parties to gain power” but a group committed to the country. “NDA is a group committed to the nation first. It must have been assembled in the beginning after a long period of 30 years. But today I can say that NDA is an organic alliance in the political system of India and great leaders like Atal Bihari Vajpayee, Parkash Singh Badal, Balasaheb Thackeray... who had sown the seed... the people of India have nurtured it with trust and turned that seed into a fruitful one. We all have the legacy of such great leaders and we are proud of it,” he said.

# FROM THE FRONT PAGE

# Before the oath, reachout to allies, states & Opposition

This was not his style, Modi said, adding: “The country won’t run as per breaking news, *yeh maan ke chaliye* (let that be clear).”

## ‘Organic alliance’

Calling the NDA “not a collection of some parties for the sake of power (a swipe at INDIA),” Modi said it stood on the shoulders of Atal Bihari Vajpayee, Parkash Singh Badal, Balasaheb Thackeray, George Fernandes, Sharad Yadav who “sowed this seed... that has become a tree”. Interestingly, those sitting on the dais with him, like Nitish Kumar, Naidu and HD Kumaraswamy of the JDS, have been in and out of the NDA in the past.

## ‘Not a defeat’

Avoiding any reference to the 63-seat dip, Modi talked about the “resounding” NDA victory. “*Na haare the, na haare hain* (We did not lose then, we haven’t lost now)... Everyone knows it is a government of the NDA. *To haare kaise bhai* (So, how did we lose)?” In contrast, Modi said, “Even after 10 years, the Congress has not been able to touch 100. Add the seats of the Congress in the past three elections... we got more than that this time.”

Explaining the BJP’s relatively muted reaction to the results, he said: “We know how to digest victory. We don’t spread *ummaad* (hysteria). We don’t mock the defeated.”

## ‘22 states... India’s spirit, soul’

Modi stressed on the NDA’s geographical expanse, saying its parties represented diverse social groups, thus tacitly bringing in a social justice and religious diversity angle — two issues which INDIA is believed to have used to its advantage in these elections. “See the strength of democracy that people have given the NDA a chance to serve them in 22 states. Our alliance mirrors India’s spirit and soul. There are 10 states in India where tribals have a significant presence. Among these, the NDA is serving in seven. We are dedicated to *‘Sarva Panth, Sama Bhava* (All Religions, Same Spirit).”

Hailing BJP workers from Odisha for the party’s victory there in the Assembly elections and its clean sweep of the Lok Sabha seats, with a slogan of “*Mahaprabhu Jagamath*”, Modi added: “Be it Goa or Northeast, where Christians are in significant numbers, we have had a chance to serve the people... In South India, the NDA has laid the foundation of a new politics.”

## ‘10 more years’

According to Modi, the NDA partners were also bound together by the fact that “good governance was common to all”. He cited his term in Gujarat, Chandrababu Naidu’s previous government in AP and Nitish Kumar’s work in Bihar as exam-

ples. He added, “The country has lived under the NDA for 10 years. People saw what a government is, who it works for, for the first time. In the next 10 years, the NDA government — it will be there for the next 10 years, I say it seriously — will bring good governance, development and minimal *dakhla* (interference) to the lives of the middle-class. We will write a new chapter of *Vikas*, good governance, and fulfill the dreams of developed India.”

## ‘Oppn not vipaksh to nation’

Slamming the Opposition over its statements raising questions on the functioning of EVMs, Modi alleged that their aim was to “discredit Indian democracy globally”. “On result day, I asked someone, ‘EVM *zinda hai ya mar gaya* (are EVMs alive or dead)?’. They wanted to discredit Indian democracy. But by the evening of 4 June, the EVMs rendered them quiet. This will be repeated in 2029. They went to the Supreme Court over the matter.” At the same time, Modi reached out to them as well. “Democracy teaches us to respect everyone. I congratulate even Opposition members,” he said, adding that he missed “quality debates” in Parliament and hoped to have those this time. He said that his political rivals were “vipaksh (opposition)” to the government, not the nation.

# Satellite-based road toll collection system: NHAI invites global bids

MUKESH JAGOTA  
New Delhi, June 7

**FOR BARRIER-LESS** toll collection on highways and charge users only for the distance covered, the government has invited initial bids or an expression of interest (Eoi) from companies in India and abroad to implement Global Navigation Satellite System (GNSS) based Electronic Toll Collection (ETC).

The objective of this global Eoi is to identify qualified and

experienced agencies for procurement of robust, scalable and efficient Toll Charger Software, the bid document issued by Indian Highways Management Company Ltd (IHMCL) said.

IHMCL has been promoted by the National Highways Authority of India (NHA) with its Concessionaires and Financial Institutions to carry out electronic tolling and allied works.

The scope of work broadly includes the precise geo-refer-

enced map making and development of scalable and robust real-time GNSS-based Toll Charger Software. As per the Eoi document the government plans to go live with the GNSS on 2000 km in the first three months of signing the contract and go live pan-India in 24 months. Initially, dedicated lanes for GNSS have been proposed. As GNSS-based ETC becomes more widespread, all lanes will eventually be converted to GNSS lanes.

**NHPC Limited**  
(A Government of India Enterprise)

CIN: L40101HR1975GOI032564  
Regd. Off. : NHPC Office Complex, Sector- 33, Faridabad-121003 (Haryana) India

**NOTICE INVITING E-TENDER (PRESS NOTICE)**

Tender Id : 2024\_NHPC\_809331\_1 Dated: 31.05.2024

Online Bids are invited by NHPC Limited Faridabad, India through **International Competitive Bidding in Single Stage -Two Part Bidding** Basis (i.e. Part-I: QR + Technical- Bid and Part-II: Financial Bid) from eligible bidders for “**Selection of Solar Power Generators For Setting up of 1200 MW (1.2 GW) ISTS (Inter State Transmission System) Connected Solar Power Projects on anywhere in India basis under Tariff Based Competitive Bidding**”.

Complete NIT and Tender Documents can be downloaded and submitted through the portal <https://eprocure.gov.in/eprocure/app>. The site can also be viewed through e-procurement corner of NHPC website [www.nhpcindia.com](http://www.nhpcindia.com) and CPP Portal. The last date of submission of online bids is **29.06.2024**. For further details, please visit <https://eprocure.gov.in/eprocure/app>. Bidders shall register themselves on the website to submit their bids. Subsequent amendments, if any, shall be posted only on the aforesaid websites, hence Bidders are advised to visit websites regularly.

Email: [contcivil1-co@nhpc.nic.in](mailto:contcivil1-co@nhpc.nic.in) General Manager (CC-1)

**GUJARAT HOTELS LIMITED**

Regd. Office: WelcomHotel Vadodara,  
R C Dutt Road, Alkapuri, Vadodara - 390 007  
CIN: L55100GJ1982PLCO05408  
Tel No. : 0265-2330033  
Website : [www.gujarathotels.com](http://www.gujarathotels.com) E-Mail: [ghlinvestors@yahoo.co.in](mailto:ghlinvestors@yahoo.co.in)

## NOTICE

### Transfer of unclaimed Dividend and Equity Shares of the Company to the Investor Education and Protection Fund

Members are hereby informed that unclaimed dividend for the financial year 2016-17 and the Equity Shares of the Company in respect of which dividend entitlements have remained unclaimed for seven consecutive years from the date of transfer to Unpaid Dividend Account of the Company will be due for transfer to the Investor Education and Protection Fund of the Central Government (IEPF) on 14<sup>th</sup> September, 2024, pursuant to the provisions of Section 124 of the Companies Act, 2013, read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016. The relevant details are available on the Company’s website [www.gujarathotels.com](http://www.gujarathotels.com) under the section ‘Investor Relations’ in sub-section ‘General Information’. Individual letters in this regard are being sent to the concerned Members at the address registered with the Company/ the Depository Participants.

Members are advised to lodge their claims in respect of the above by sending an email at [ghlinvestors@yahoo.co.in](mailto:ghlinvestors@yahoo.co.in) or by contacting Company’s Registrar and Share Transfer Agent- M/s. MCS Share Transfer Agent Limited at F-65, 1<sup>st</sup> Floor, Okhla Industrial Area, Phase-1, New Delhi 110 020, Phone 011-41406149, email: [helpdeskdelhi@mcsregistrars.com](mailto:helpdeskdelhi@mcsregistrars.com) by 13<sup>th</sup> September, 2024. If any valid claim is not received by that date, the Company, in accordance with the aforesaid provisions of law, shall transfer such dividend and shares to the IEPF.

**For Gujarat Hotels Limited**  
**Sneha Gupta**  
Company Secretary

Date: 7th June, 2024

**POONAWALLA FINCORP LIMITED**

CIN: L51504PN1978PLC209007  
Registered Office : 201 and 202, 2nd Floor, AP81, Koregaon Park Annex, Mundhwa, Pune - 411036; Phone : 020-67808090  
Website : [www.poonawallafincorp.com](http://www.poonawallafincorp.com); Email : [secretarial@poonawallafincorp.com](mailto:secretarial@poonawallafincorp.com)

**NOTICE TO SHAREHOLDERS**

**Transfer of equity shares of the Company to Investor Education and Protection Fund (‘IEPF’)**

This has reference to the applicable provisions of the Companies Act, 2013 (the ‘Act’), read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 (the ‘IEPF Rules’) thereto, both as amended from time to time. Pursuant to the Act read with the said IEPF Rules, **unclaimed dividend for the past 7 years shall be transferred to IEPF and all shares in respect of which dividend has not been claimed for 7 consecutive years or more shall also be transferred to the IEPF Authority.**

In compliance with the requirements set out in the IEPF Rules, the Company has communicated individually to the concerned Shareholders along with the details of amount(s) which are lying unclaimed against their respective folio/demat account. The details of such unclaimed dividend(s) are also available on the website of the Company on <https://poonawallafincorp.com/investor-info.php>.

The concerned Shareholders whose shares are liable to be transferred to the IEPF are advised to claim the unclaimed dividends by **August 28, 2024**, in the following manner, by writing to **Link Intime India Private Limited, Registrar and Share Transfer Agent of the Company (RTA)**.

**Mode of claiming the unclaimed dividends:**

- **For shares held in physical form:** Investor Service Request Form No. ISR-1, Form No. ISR-2 and Form No. SH-13 (Nomination Form) duly filled as per the instructions stated therein along with the supporting documents including original cancelled cheque stating your name as the account holder along with duly signed request letter. The Investor Request Forms can be accessed on the RTA’s website: [www.linkintime.co.in](http://www.linkintime.co.in) at <https://web.linkintime.co.in/KYC-downloads.html>. These forms can also be accessed on the Company website: <https://poonawallafincorp.com/investor-info.php>.
- **For shares held in electronic form:** Copy of the client master list is to be submitted. Payment will be made to the Bank Account registered against the demat account.

**How the dividend(s)/equity share(s) transferred to IEPF can be reclaimed?**

As per the IEPF Rules, an online application is required to be made in prescribed e-Form IEPF-5, which is available on the website of MCA at [www.iepf.gov.in](http://www.iepf.gov.in), and sending the physical copy of the same duly signed (as per the specimen signature recorded with the Company), to the attention of Ms. Shabnum Zaman, Company Secretary and Nodal Officer, Poonawalla Fincorp Limited, 201 and 202, 2nd Floor, AP81, Koregaon Park Annex, Mundhwa, Pune, Maharashtra, 411 036, along with the copy of IEPF entitlement letter issued by the RTA, acknowledgement/challan and requisite documents enumerated in web Form/e-form IEPF-5.

Please note that the e-form/web form is also available on the website of the Company at <https://poonawallafincorp.com/investor-info.php> or at **Ministry of Corporate Affairs (iepf.gov.in)**. For further queries refer to the procedures for claiming the shares and dividend from IEPF available on the Company’s website at <https://poonawallafincorp.com/investor-info.php> (Path: **Unclaimed/Unpaid Dividends > Web e-form IEPF-5 with instruction kit**).

In view of the above, the Shareholders are advised to encash the dividend warrant(s) which have remained unencashed for the last 7 consecutive years **before August 28, 2024**.

**Whom should you contact for information, assistance or clarifications on the above matters?**

Link Intime India Private Limited  
Unit - **Poonawalla Fincorp Limited**  
C-101, 247 Park, Lal Bahadur Shastri Marg, Vikhroli (West), Mumbai, Maharashtra, 400 083.  
Tel No. : +91 810 811 6767.  
Email Id : [iepf.shares@linkintime.co.in](mailto:iepf.shares@linkintime.co.in)

Yours faithfully,  
**For Poonawalla Fincorp Limited**  
Sd/-  
**Shabnum Zaman**  
Company Secretary  
ACS No. 13918

Date : June 07, 2024  
Place : Pune

# ‘Slow-moving elephant’ hangs over RBI pivot

Pranjul Bhandari, chief India economist, HSBC believes the government’s statement implies that if domestic drivers like good monsoon help lower food prices, the RBI would be open to cutting rates before the Fed. “But for that, we think the RBI will have to clearly see its modelled one-year-ahead inflation forecast asymptote to 4%,” she said, adding that while the policy seems to be marginally hawkish, there are some statements that seem to have sown the seeds of looser monetary policy down the line.

However, Abheek Barua,

chief economist, HDFC Bank, said any rate cut action could end up being aligned with the timing of the Fed’s rate cut cycle to limit financial market volatility. “The RBI remains in a wait and watch mode to assess domestic developments like the monsoon performance, food inflation, and the new fiscal strategy before moving on rates. We continue to see the possibility of a rate cut in Q4 2024,” added Barua.

Bankers believe that RBI’s upwards GDP revision reflects the economy’s continued robust growth post-pandemic.

Said Dinesh Khara, chairman, SBI, “Domestic growth inflation outlook has moved favourably with inflation moving below 4% in the second quarter.”

According to Zarin Daruwala, CEO, India and South Asia, Standard Chartered Bank, RBI’s ongoing focus on inflation may give it room for rate cuts in the coming months. “The repo rate was left unchanged as expected but the upward revision in the full year GDP estimate to 7.2% was encouraging,” said Daruwala.

HSBC’s Bhandari also added that three factors — monsoon, Budget and neutral rates will decide the future of rate cuts. If all these three align, there could be some easing. “RBI aims to announce its updated assessment of real neutral rates shortly. If it’s a gentle rise (from say 1% as per RBI’s previous assessment to 1.5%), there could be space for 25-50 bp easing, but if it is a doubling of neutral rates, then there may not be much room for rate cuts,” she added.

India’s economy remains resilient, Das said, adding he expects manufacturing activity to gain ground and consumption recover. Rural demand is also being aided by a pick-up in farm activity.

Investment activity is likely to stay on track, with high capacity utilisation, balance sheets of banks and corporates are healthy and the government will keep up infrastructure spending, the MPC said in its written outlook. Among other measures, RBI has increased the bulk deposit limit from ₹2 crore to ₹3 crore for banks. It has also proposed to set up a digital payments intelligence platform that will do real-time data sharing across the digital payments’ ecosystem.

The central bank is also assessing whether further measures are needed to slow down the growth in banks’ lending towards unsecured loans and non-banking finance companies (NBFC). “Recent data suggests that there is some moderation in these loans and advances,” Das said, while announcing the interest rate decision. “We are closely monitoring the incoming data to ascertain if further measures are necessary.”

Das also urged the boards and top management of regulated entities to ensure that risk limits and exposures for each line of business are kept “well within their respective risk appetite framework”.

**PUNJAB STATE POWER CORPORATION LIMITED**  
(Regd. Office: PSEB Head Office, The Mall, Patiala - 147001)  
Corporate Identity Number: U40109PB2010SC033813  
Website: [www.pspcl.in](http://www.pspcl.in) Mobile No. 96461-20640

**Tender Enquiry No. 1658/CMC/O&M/PC-2532 Dated 06.06.2024**

Chief Engineer/ O&M (P&P Cell-1) GHPT Lehra Mohabbat invites E-tender for the Procurement of Railway track material for Railway siding at GHPT Lehra Mohabbat. Quantity as per NIT. For detailed NIT & Tender Specification please refer to <https://eproc.punjab.gov.in> from 06.06.2024 from 17:00 PM onwards.

**Note:** Corrigendum & addendum, if any will be published online at <https://eproc.punjab.gov.in>

No. 34301/PSPCL GHPT 26/24

**PUNJAB STATE POWER CORPORATION LTD.**  
(Regd. Office PSEB Head Office, The Mall, Patiala-147001)  
Office- Addl. SE, Operation Division Gurdaspur.

**Open Tender Enquiry No. 01/2024-25 dated**

**Description:** Erection and Laying of 3 No. XLPE Cable 3/C 150 Sq mm by Underground Horizontal Boring at KM/EP No. 761-762 between Gsp and Dinanagar railway station on Asr-PTK section as per specification of Indian Railways.

|   |                                 |
|---|---------------------------------|
| Start Date for sale of Specification/tender documents - | 24-06-2024 up to 11:00 Hrs Last |
| Date for sale of Specification/tender documents -       | 24-06-2024 up to 11:00 Hrs      |
| Last date for Bid submission-                           | 24-06-2024 up to 11:00 Hrs      |
| Bid Opening Date -                                      | 25-06-2024 at 11:30 Hrs         |

**Note:-** It is informed that incase tender process is not completed due to any reason, no corrigendum will be published in newspapers. Details regarding corrigendum may be seen on office PSPCL web site [www.pspcl.in](http://www.pspcl.in). Terms and conditions may be downloaded from web site [www.pspcl.in](http://www.pspcl.in)

No. 34280/PSPCL C 265/24

**U.P. COOPERATIVE SUGAR FACTORIES FEDERATION LTD**  
9-A, RANA PRATAP MARG, LUCKNOW-226001  
Tel No. (0522) 2612949, (0522)2628310, Fax: (0522) 2627994  
Email: [upsugarfed@yahoo.co.in](mailto:upsugarfed@yahoo.co.in) | Website: [www.upsugarfed.org](http://www.upsugarfed.org)

**Ref no. UPSUGARFED/8697/GM(AT) Proj Fin/36A Date: 07.06.2024**

**ई-टेंडर नोटिस**

प्रस्तावित कार्य का विवरण एवं सविस्तर जानकारी के लिए कृपया 2024-25 के दौरान उपरोक्त निम्नलिखित आडवॉरिंग को देखें।

|   |   |   |
|---|---|---|
| ई-निविदा को ऑनलाइन पर पंजीयन कराने का समय | ई-निविदा को ऑनलाइन पर पंजीयन कराने का समय | ई-निविदा को ऑनलाइन पर पंजीयन कराने का समय |
| 18.06.2024 8:00 AM                        | 18.06.2024 11:00 AM                       | 18.06.2024 3:00 PM                        |

प्रस्तावित कार्य का एक अंश समस्त निविदाओं को बिना कारण बताये निरस्त करने का अधिकारी सुरक्षित रहेगा।

ई-निविदा प्रक्रिया शुल्क - ₹. 10,000 आरक्ष प्रतिस आरक्षी।  
ई-निविदा प्रक्रिया शुल्क - ₹. 10000.00 + 18% जी.एस.टी. (नान रिफ़ंडेबल)

**प्रबन्ध निदेशक**

**WELSPUN ENTERPRISES LIMITED**  
CIN: L45201GJ1994PLC023920

Reg. Office: Welspun City, Village Versamedhi, Taluka Anjar, District Kutch, Gujarat - 370 110  
Tel: +91 2836 662222 Fax: +91 2836 279010  
Corp. Office: Welspun House, Kamala City, Senapati Bapat Marg, Lower Parel (W), Mumbai, Maharashtra - 400013  
Tel: +91 22 6613 6000/2490 8000 Fax: +91 22 2490 8020  
Email: [companysecretary\\_wel@welspun.com](mailto:companysecretary_wel@welspun.com); website: [www.welspunenterprises.com](http://www.welspunenterprises.com)

**NOTICE**

Pursuant to Rule 10 of The Companies (Management and Administration) Rules, 2014 of Section 91 of the Companies Act, 2013 and SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015 **NOTICE IS HEREBY GIVEN** that the Share Transfer Books and the Register of Members of the Company will remain closed from **Saturday, July 06, 2024 to Monday, July 08, 2024** (Both days inclusive) for the purpose of Annual General Meeting of the members of the Company.

**For Welspun Enterprises Limited**  
Sd/-  
**Nidhi Tanna**  
Company Secretary  
ICSI Membership No. : ACS - 30465

Place: Mumbai  
Date: June 07, 2024



પુસ્તકો-ગાયલેશ માટે ઘસારો : ઉનાળુ વેરેશન પુસ્તકોમાં હવે એકાદ સપ્તાહનો સમય બાકી રહ્યો છે, ત્યારે બાળકોના નવા ધોરણના પુસ્તકો તેમજ ગાયલેશની ખરીદી માટે વાલીઓની ઠો.શબ્દ વધી પડી છે, ઉપરાંત બંને દ્રવ્યમાં ભુજની શાપરની ડુકાનમાંથી યુનિફોર્મની ખરીદી કરતા વાલીઓ અને શાળાં સ્ટેશનરીના વેપારી પાસે પુસ્તકો ખરીદતાવાલી અને બાળકો નજરે પડે છે. (તસવીર : મયુર ચૌહાણ)



આધાર-પુરાવા વિનાના ખાદ્ય તલનો જથ્થો ઝડપાયા બાદ કોલેજ પોલીસે કબજે કરેલી ટ્રક અને બાજુમાં જત કારચેલા તલના ખાચક. (તસવીર : જીવરાજ ગઢવી)

### મુંદરા-માંડવી માર્ગે આધાર-પુરાવા વિનાનો ખાદ્ય તલનો જથ્થો ઝડપાયો

ભુજ, તા. ૭ : મુંદરાથી માંડવી તરફ જતા માર્ગ પરથી આધાર-પુરાવા વિનાના ટ્રક ૨,૮૦,૦૦૦નો ખાદ્ય તલનો જથ્થો હવે જતા ટ્રકવાહીમાં કોલેજ પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે તલના ૩૦ બાચક તથા ટ્રક મળી કુલ રૂ. ૧૨,૮૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

### ગાંધીધામ ન્યાય મંદિરમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી

ગાંધીધામ, તા. ૭ : અહીંના બાર એસોસિએશન દ્વારા તથા કોર્ટ દ્વારા તથા નવા વિભાગના સહયોગથી વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીધામ ન્યાય મંદિર ખાતે કોર્ટે પરિસરમાં અધિક સેશન્સ જજ એ.એમ. મેઘાણ તથા અધિક ચીફ જ્યુ. મેજ. એમ.એચ. ચૌહાણ, એમ.એ. રોષન, એમ.બી. ભાવણર, પી.કે. વ્યાસ તથા અધિક જ્યુ. મેજ. (ક.ક.) એ. શાહુ દ્વારા તથા કોર્ટના રજિસ્ટ્રાર શ્રી ભાવણર દ્વારા વૃક્ષોનું વાવેતર કરાયું હતું.

PGVCL પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ નિયામક મકાન રોડ, રાજકોટ. CIN : U40102GJ2003SC0042908, www.pgvcil.com

નગર સેવા સદન, ભુજ-કચ્છ. ભુજ નગર સેવા સદન પાણી પુરવઠા શાખા હસ્તકનો મહાવેગ ગેટ પાસે આવેલ જર્જરિત ટાંકો તોડી પાડવા માટેના તેમજ તમામ સાળિયા અને મલબો ઉપવાસ કામના ટેન્ડર કરવામાં આવેલ છે.

પારકેટના મોસમી ફાલનો ઈજારો આપવા અંગે સરકાર સુબનગર દાંતીવાડા વૃષ્ટિ યુનિવર્સિટી સંચાલિત, સોહાવા-કચ્છ વેનુના ડિસ્ટ્રિક્ટ્યુલર ખાતેના ઇનાઉટકાંડ પીળી ખારેકે ઝાડના ટ્રાન્ક ૨૦૧૧, લાલ કાંચે કોસીલોસ ૧૬૬ ખાતવા પ અને કોસીલોસ ૬૩-૨ ટ્રાન્કના પદ મળીને કુલ ૩૧૬ ટ્રાન્કનો ઈજારો વધે-૨૦૨૨નો અહેદ કરણથી નીચેની તારીખે અને સમયે સમ્પાદે છે.

વેલરપન એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ. વેલરપન એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ, ઈસ્ટ સમાચાર ૨૫ કચ્છમિત્ર, તા. ૦૮/૦૬/૨૦૨૪. ICSI Membership No.: ACS - 30465

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, ભુજેડી સી.ડી.-૬૪૪. જાહેર વિદ્યાલય. જાહેર વિદ્યાલય ભુજેડી સી.ડી.-૬૪૪. ઈસ્ટ સમાચાર ૨૫ કચ્છમિત્ર, તા. ૦૮/૦૬/૨૦૨૪. ICSI Membership No.: ACS - 30465

ગુજરાત પ્રમૂલ્ય નિયંત્રણ બોર્ડ. ગુજરાત પ્રમૂલ્ય નિયંત્રણ બોર્ડ, સેક્ટર-૧૦-એ, ગાંધીનગર, ૩૮૨૦૧૦. ઈસ્ટ સમાચાર ૨૫ કચ્છમિત્ર, તા. ૦૮/૦૬/૨૦૨૪. ICSI Membership No.: ACS - 30465

ગુજરાત પ્રમૂલ્ય નિયંત્રણ બોર્ડ. ગુજરાત પ્રમૂલ્ય નિયંત્રણ બોર્ડ, સેક્ટર-૧૦-એ, ગાંધીનગર, ૩૮૨૦૧૦. ઈસ્ટ સમાચાર ૨૫ કચ્છમિત્ર, તા. ૦૮/૦૬/૨૦૨૪. ICSI Membership No.: ACS - 30465

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ, પ્રથમ માળે, જી.કે. જનલ ટોર્નિસ્ટર સામે, ભુજ-૩૦૦ ૦૦૧, જિ. કચ્છ, ટેલિફોન નં. ૦૨૩૨-૨૨૫૫૧૮. Email ID: rmbhuj@gidcgujarat.gov.in

કચ્છમિત્ર APPOINTMENTS. કચ્છમિત્ર APPOINTMENTS. કચ્છમિત્ર APPOINTMENTS.

CARGO જોઈએ છે TATA MOTORS. કાર્ગો મોટર્સ પેસેન્જર વીહીલ ના નવા સોલ્યુશન સાથે આપણે ભવિષ્ય ઉજવવાના ભાવોમાં સેલ્સ એક્ટિવેટિવ - જુલા-૨૦. આઈસી પગાર + ઈલેક્ટ્રિક-ઓટોમોબાઇલ્સ ઉદ્યોગ માં શ્રેષ્ઠ કાર્ગોવાળી FMCQ/TELECOM ઓટોમોબાઇલ્સ ક્ષેત્રના ખાસકર ને પ્રથમ પસંદગી. ઉપરની લાભકારી ઘટના વિચારણાની અરજીઓ આમંત્રિત કરીએ છીએ.

કચ્છમિત્ર એપોઈન્ટમેન્ટ્સ સહકારી કાર્યાલય ત્રણ દિવસ. એપોઈન્ટમેન્ટ્સ સહકારી કાર્યાલય ત્રણ દિવસ. એપોઈન્ટમેન્ટ્સ સહકારી કાર્યાલય ત્રણ દિવસ.

ગાય અને ભેંસના દૂધ વેચાણનો ઈજારો આપવા અંગેની જાહેરાત. ગાય અને ભેંસના દૂધ વેચાણનો ઈજારો આપવા અંગેની જાહેરાત. ગાય અને ભેંસના દૂધ વેચાણનો ઈજારો આપવા અંગેની જાહેરાત.

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ. વાંદાસા વિભાગ, રાંપનગર. વીજ પુરવઠો બંધ રહેવા બાબતની જાહેરાત. આથી માનવાત વીજ પુરવઠો બંધ રહેવા અંગેની જાહેરાત. આથી માનવાત વીજ પુરવઠો બંધ રહેવા અંગેની જાહેરાત.

RP - Sanjiv Goenka Group Growing Legacies PCBL WE ARE HIRING. DCS ENGINEER - PRODUCTION B. E./B. Tech. (Chemical) with 3 to 6 years of experience. FIELD ENGINEER - PRODUCTION Diploma (Chemical) with 3 to 4 years of experience.

ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ. ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ. ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ.

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ, પ્રથમ માળે, જી.કે. જનલ ટોર્નિસ્ટર સામે, ભુજ-૩૦૦ ૦૦૧, જિ. કચ્છ, ટેલિફોન નં. ૦૨૩૨-૨૨૫૫૧૮. Email ID: rmbhuj@gidcgujarat.gov.in

